

Date: 03/08/2021

To,
Gen. Manager (DCS)
BSE Limited.
P J Towers, Dalal Street,
Fort, Mumbai-400001

SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.

REF: COMPANY CODE BSE: 531257 (PRATIKSHA CHEMICALS LIMITED)

Dear Sir,


Please find enclosed herewith copy of Advertisement given in newspaper of unaudited financial results for the quarter ended on 30th June, 2021 in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on 02nd August, 2021.

You are requested to take the same on your record.


Thanking You.

Yours Sincerely,

FOR, PRATIKSHA CHEMICALS LIMITED



MR. JAYESH PATEL
DIRECTOR
(DIN: 00401109)



PRATIKSHA CHEMICALS LIMITED

Regd. Off : 3rd Floor, H. K. Complex , Nr. Dharnidhar Derasar, Paldi, Ahmedabad-380 007 India
Ph. 26632390, 26609530 Fax No : +91 79 26612843.

Website : <http://www.dharapratiksha.com> E-mail : exports@dharapratiksha.com

CIN : L24110GJ1991PLC015507

Factory : 195/2, Near Natraj Industrial Estate, Village Iyawa Vasna, Sanand.
(Dist : Ahmedabad) India. Phone 02717-284350

Birla tells govt he is willing to give up promoter stake in Vodafone Idea

Industrialist Kumar Mangalam Birla has expressed willingness to offer his group's 27 per cent stake in Vodafone Idea Limited (VIL) to any government or domestic financial entity in order to keep the stressed telecom company alive.

The Aditya Birla Group chairman and promoter of VIL made the suggestion in a letter to Union Cabinet Secretary Rajiv Gauba on June 7. The VIL debt has more than trebled in the last four years to Rs 1.6 trillion as of end of March 2021, from around Rs 37,000 crore in FY16. This includes deferred spectrum obligations and adjusted gross revenue (AGR) liabilities.

Birla made the suggestion to give up his control of the company more than a month before the Supreme Court dismissed the company's application for recalculation of the AGR dues, highlighting the need for urgent measures from the government.

"It is with a sense of duty towards 27 crore (270 million) Indians connected by VIL, I am more than willing to hand over my stake in the company to any entity-public sector/government/domestic financial entity or any other that the government may consider worthy of keeping the company as a going concern," Birla said in his letter.

The VIL board had last September announced a plan to raise Rs 25,000 crore but investors have not been forthcoming in the absence of government support.

The fundraising is, however, tough given VIL's negative net worth and consistent losses. The company has cumulatively lost Rs 1.37 trillion in the last five years. As a result, its net worth declined from around Rs 24,000 crore in FY16 to negative Rs 38,000 crore in FY21.

While Vodafone Plc has

refused to throw good money after bad or make additional equity investment in VIL, AB Birla Group's hands are also tied given the mismatch between the capital requirement and group finances.

In FY21, the group listed companies (ex-VIL) reported net profit of Rs 7,132 crore against VIL's net loss of around Rs 44,200 crore. In the last five years, AV Birla group companies cumulatively earned net profits of Rs 37,600 crore--a fraction of VIL's cumulative loss of Rs 1.37 trillion since FY16.

On the balance sheet side, VIL's cumulative reserves & surplus of negative Rs 67,000 crore are equivalent to nearly half of the combined net worth of the group's other listed companies.

Analysts say that VIL losses could potentially swamp the group finances making Birla wary of making additional investments in the company. They say it's better for the group to cut its losses in VIL and redirect group capital and resources to profitable businesses such as cement, metals, financial services, fashion and retail.

VIL had last raised Rs 25,000 crore worth of equity from its shareholders including promoters through a rights issue in April 2019. The company was left with cash & bank balance of only around Rs 2,200 crore at the end of March this year.

Birlas' foray into telecom dates back to 1995--incidentally the same year when Kumar Mangalam took the reins of the company following his father's death. Idea Cellular was introduced in 2002 and in 2017 it merged with Vodafone in a \$23-billion deal. The merger was completed in August 2018.

The Birlas own over 27 per cent stake in VIL while Vodafone Plc holds more than 44 per cent in the company. At the time of

the merger, the company stock was trading at Rs 34, it closed at Rs 8.25 on the BSE on Monday. The current market capitalisation of VIL is at more than Rs 23,000 crore.

While the two promoters have decided against infusing fresh funds in the company, Vodafone Plc has already written off all its investment in VIL following continuous losses.

"To actively participate in the fund raising, the potential foreign investors want to see clear government intent to have a three-player telecom market (consistent with its public stance) through positive actions on long-standing requests such as clarity on AGR liability, adequate moratorium on spectrum payments and most importantly, a floor pricing regime above the cost of service. In the absence of definitive steps in this regard, the potential investors have understandable hesitation to invest," Birla wrote in his June communication.

Birla further said that VIL's financial situation would drive its operations to an irretrievable point of collapse without immediate active support from the government on these three issues.

On June 25, VIL had approached the Department of Telecommunications to seek a one-year moratorium on Rs 8,200-crore spectrum instalment which is due in April 2022. In its letter, the company said it would be unable to pay the spectrum dues because of inadequate cash generation and payment of AGR liabilities.

On July 23, the Supreme Court dismissed the petitions of VIL and Bharti Airtel seeking correction in claimed errors in calculating the AGR.

VIL had calculated its remaining AGR dues at around Rs 21,500 crore after making a payment of Rs 7,800 crore. However, DoT concluded the company's total AGR liability was around Rs 58,000 crore.

India PMI manufacturing up at three-month high in July as lockdowns ease

Manufacturing activity in India rebounded to a three-month high in July after contracting in the previous month, a private sector survey showed on Monday.

The IHS Markit Manufacturing Purchasing Managers' Index (PMI) rose to 55.3 in July from 48.1 in June, well above the 50-level separating growth from contraction. Factory activity in June had slipped into contraction for the first time in 11 months.

The PMI corroborated the upswing in other parameters of the economy. For example, goods and services tax collection in July stood at Rs 1.16 trillion, as against Rs 92,849 crore in June.

"It's encouraging to see the Indian manufacturing industry recover from the blip seen in June. Output rose at a robust pace, with over one-third of companies noting a monthly expansion in production, amid a rebound in new business and the easing of some local Covid-19 restrictions," said Pollyanna DeLima, economics associate director at IHS Markit.

Factory orders rose amid reports of improved demand and the easing of restrictions. Strengthening international demand contributed to the uptick in total order books. New export orders expanded markedly in July, following a moderate contraction in June.

De Lima said if the pandemic continued to recede, a 9.7 per cent annual increase in industrial production for the calendar year 2021 was expected. A marginal increase in employment ended a 15-month chain of job shedding.

"The PMI also brought the positive news of job creation in the manufacturing sector. Although marginal, the rise in employment was the first since the onset of Covid-19. With firms' cost burdens continuing

to rise, however, and signs of spare capacity still evident, it's too early to say that such a trend will be sustained in the coming months," De Lima said.

Barclays Chief India Economist Rahul Bajoria said the employment PMI rose above 50 for the first time in 16 months, which might reflect positively for the services sector as well.

There was an increase in input costs. Output charges rose only slightly, however, as several companies absorbed additional cost burdens amid efforts to boost sales. However, the Reserve Bank of India is likely to maintain the status quo in its policy rate in this month's policy review as inflationary pressures have begun to ease.

De Lima said policymakers would welcome evidence that inflationary pressures were starting to abate. Firms signalled the slowest increases in input costs and output charges for seven months.

"Hence, we expect the RBI to keep interest rates unchanged in its August meeting as it continues to support growth," she said.

The Monetary Policy Committee (MPC) will hold its review meeting for three days from August 4.

Bajoria said while the input cost PMI fell slightly, it remained high and a similar trend was seen in output prices. This may reflect the recent levelling off in the prices of several commodities, he said. "However, as activity levels continue to improve, we expect producers to move to improve their margins by closing the gap between input and output costs," Bajoria said.

"While inflation threats remain, we expect the RBI to continue to prioritise growth and maintain an accommodative posture in the monetary policy meeting this week," he said.

IRCTC and BHEL in talks for a partnership to run private trains

Indian Railway Catering and Tourism Corporation (IRCTC) and Bharat Heavy Electricals (BHEL) are in talks for a partnership to run private trains. According to officials in the know, the two public sector undertakings (PSUs) are planning to form a special purpose vehicle (SPV) to run passenger trains on routes for which IRCTC has put in bids.

"BHEL will be putting in the money required for private rail service, while IRCTC is going to focus on operational requirements," an official said. "IRCTC's business model has not been capital expenditure-focused. It has built only operational enhancements," he added.

Bids for public private partnerships (PPPs) in passenger train operations were opened last month.

"The Ministry of Railways has received bids from both

private and public sectors to operate 29 pairs of trains with around 40 modern rakes, entailing an investment of around Rs 7,200 crore. The ministry will expeditiously complete the evaluation and decide on the bids," an official statement said.

The ministry had offered 12 clusters, but only three received bids. Megha Engineering and Infrastructures and IRCTC are the only bidders who have participated in the bid round.

In October last year, L&T Infrastructure Development Projects, IRB Infrastructure Developers, GMR Highways, BHEL, and IRCTC had figured in the list of companies that expressed interest in running passenger trains. Spain's Construcciones y Auxiliar de Ferrocarriles had also responded to the railway ministry's request for qualifications (RFQ).

Barbeque Nation, LIC Housing Finance face heat on independent valuation

More companies are in a tricky situation for not appointing an independent valuer while going in for preferential allotment of shares. Mortgage lender LIC Housing Finance and restaurant chain Barbeque-Nation Hospitality are the latest companies to face the heat over the issue.

Stock exchanges last week asked them to explain why they did not obtain a valuation report from a registered independent valuer while pricing their preferential allotment.

This came at the heels of a legal dispute between PNB Housing Finance and markets regulator Securities and Exchange Board of India (Sebi) over the issue.

Both LIC Housing and Barbeque Nation got a letter from the BSE and the NSE seeking clarifications on compliance with the provisions of articles of association (AoA).

Last month, LIC Housing said it would allot 45.4 million shares to parent Life Insurance Corporation (LIC) at Rs 514.25 apiece to raise Rs 2,334 crore by preferential allotment of shares on a private placement basis. Barbeque Nation is looking to raise Rs 100 crore by issuing 1.18 million shares at Rs 849 apiece to the Massachusetts Institute of Technology, 238 Plan Associates, and Motilal Oswal Equity Opportunities Fund.

Exchanges have said both LIC Housing and Barbeque Nation can carry on with their shareholder meeting, where this resolution will be put to vote. But the two also have been directed not to make public the voting results until the issue is examined further.

In a public disclosure made over the weekend, both companies said they are in compliance with the regulations. "...the price for the preferential allotment has been arrived at in compliance with the provisions of AoA, the Companies Act, 2013, and the Sebi (Issue of Capital and

Disclosure Requirements) Regulations, 2018, as the company being a listed company is not required to obtain a registered valuer certificate as provided under Rule 13 of the Companies (Share Capital and Debentures) Rules, 2014," stated LIC Housing in an exchange filing on Saturday.

Barbeque Nation in its filing stated: "Since the Companies (Registered Valuers and Valuation) Rules, 2017, do not apply to a listed company, Article 3.3.1(c) does not apply in relation to the proposed

issue of preference shares by the company. Therefore, there is no requirement to obtain a valuation report from a registered valuer and the price for the proposed preferential allotment has been computed in accordance with the Sebi ICDR Regulations, 2018, as certified by a chartered accountant report previously submitted to you."

Legal experts say the bone of contention in all the three cases is that while the Companies Act and the Sebi ICDR Regulations do not mandate the firms to get their shares valued by an independent valuer, their AoA -- which are internal rulebooks -- say otherwise. Sebi rules prescribe a formula which acts as a floor price for preferential allotments.

Interestingly, while the companies are saying they are following Sebi guidelines, the regulator is asking them to follow their own guidelines. Experts say companies may be confusing between prohibition and requirement.

"Sebi guidelines say an independent valuation report is not required. That doesn't mean it is prohibited. If a

company's AoA say an independent valuation report is required while doing a preferential allotment, it is quite straightforward that the company should follow what's there in its AoA. There is also a Supreme Court judgment in the Tata-Mistry case which says AoA form the bedrock for any company's management," said J N Gupta, founder of Stakeholders Empowerment Services (SES), a voting advisory firm. In its report on Barbeque Nation and LIC Housing, SES had highlighted that both companies were not following their AoA and recommended shareholders to cast 'against' votes on the resolution pertaining to the preferential allotment.

Shares of PNB Housing and Barbeque Nation currently trade above their proposed preferential allotment price, while those of LIC Housing trade at a discount.

Experts say the price discovery by an independent valuer doesn't have so much to do with the secondary market price; it is more related to other quantitative aspects.

"An aspect that needs to be considered from a corporate governance perspective is when a listed undertaking makes a preferential allotment, fairness in pricing is of critical importance, to avoid the possibility of the transaction being unfair to public shareholders," said Prashaant Vikram Rajput, partner, White & Brief Advocates and Solicitors.

The Securities Appellate Tribunal (SAT) on Monday will resume hearing in the appeal filed by PNB Housing against Sebi's directive to appoint an independent valuer before it allots Rs 4,000 crore worth of shares to private equity major Carlyle Group, former HDFC Bank chief executive officer Aditya Puri's family investment vehicle Salisbury Investments, and others.

Experts say the SAT judgment may set a precedent.



Tata Motors' net-debt-to-equity ratio at a decade high in FY21

Nearly 13 years after the acquisition of Jaguar Land Rover (JLR), Tata Motors continues to grapple in a bid to put its business on the path of sustained profitability. While its domestic business has lost money in 23 of the last 35 quarters, including the latest quarters, its British subsidiary JLR has reported losses in seven of the last 13 quarters.

JLR accounts for nearly 80 per cent of Tata Motors revenues on a consolidated basis. The losses and asset write-down at JLR have led to a steady decline in the company's equity base. The consistent losses and a mounting debt burden have also forced the company to skip equity dividends, which is now a constant complaint at Tata Motors annual general meeting. The company has not paid any equity dividend for the last five years, a record among index companies. Its shareholders had last earned an equity dividend in 2015-16.

Not surprisingly, Tata Motors had been one the

biggest laggards among index stocks in recent years. The company's stock price has remained unchanged in the last five years against nearly 100 per cent rise in the benchmark BSE Sensex during the period.

The biggest impact of the company's poor financial performance has been on its balance sheet and equity capital. Tata Motors net worth or shareholders' equity at the consolidated level is down 42 per cent in the last four years from Rs 95,428 crore in FY18 to Rs 55,246 crore now.

The result has been a sharp rise in the company's debt-to-equity ratio as it continued to borrow to fund its operations. Tata Motors gross debt-to-equity ratio (on consolidated basis) worsened to a decade high of 2.26X in FY21 while long-term debt-to-equity ratio was 1.6X in FY21, according to the Capitaline database.

The company's overall net debt-to-equity, however, was 1.4X at the end of March this year from 1.3X a year ago and a

low of 0.2X at the end of March 2016. (See the adjoining chart)

Tata Motors reported a total gross debt of around Rs 1.42 trillion at the end of March this year, up 14 per cent from around Rs 1.25 trillion a year ago. The company's borrowings have doubled in the last five years while net sales are down 8.5 per cent since FY15-16. The company, however, says that a significant part of the consolidated gross debt is accounted for by its vehicle finance subsidiary -- Tata Motors Finance (TMFL). According to the Tata Motors annual report for FY21, TMFL had gross debt of around Rs 32,800 crore at the end of March this year, accounting for around a quarter of the company's consolidated gross debt.

Tata Motor's net debt -- adjusted for cash & equivalent on its books -- is, however, around half its gross debt. The company was sitting on cash & equivalent worth around Rs 66,000 crore, most of it on the books of its British subsidiary

continued on Pg no. 2

PRATIKSHA CHEMICALS LIMITED				
REGD. OFFICE: 3RD FLOOR, H K COMPLEX, OPP. DHARNIDHAR DERASAR, VASNA, AHMEDABAD - 380007				
CIN : L24110GJ1991PLC015507 www.pratikshachemicals.in				
PH : 079-26632390 E-MAIL: exports@dharaipratiksha.com				
EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.06.2021 (Rs. In Lacs)				
Sr. No	PARTICULARS	Quarter ended on 30th June, 2021	For the year ended on 31st March, 2021	Corresponding 3 Months Ended on 30th June 2020
1	Total income from operations	345.49	1136.12	140.94
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	13.16	42.64	1.49
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	13.16	42.64	1.49
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	10.81	46.64	1.11
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	10.81	46.64	1.11
6	Equity Share Capital	557.03	557.03	557.03
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	(221.64)	(232.46)	(277.98)
8	Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations)			
	Basic :	0.19	0.84	0.02
	Diluted :	0.19	0.84	0.02

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.pratikshachemicals.com)
2. The result of the Quarter ended on 30th June, 2021 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 2nd August, 2021

BY ORDER OF THE BOARD OF DIRECTORS, FOR, PRATIKSHA CHEMICALS LIMITED
SD/-
JAYESH PATEL
DIRECTOR
(DIN: 00401109)

Place : Ahmedabad
Date : 2nd August, 2021

ધી જ્યુજલાઇઝ

વર્ષ : ૨૭ અંક : ૨૮૪ તા.૩-૦૮-૨૦૨૧ પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : રણછોડ એન. શાહ સહ તંત્રી : રાધિકા ગંજવાણ

થોડા અઠવાડિયાથી બજારમાં નબળાઈનો માહોલ

છેલ્લા થોડા અઠવાડિયાથી બજારમાં નબળાઈનો માહોલ હતો અને તે પછી હવે સેન્ટીમેન્ટમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે અને મુખ્યત્વે જે રીતે રોલઓવર પૂર્ણ થયું તેને કારણે સ્પષ્ટ દેખાય છે કે આગામી સમયગાળામાં અને ખાસ કરીને ઓગસ્ટ મહિનાની તહેવારોની સિઝનમાં બજારનો મુડ એકદમ ભુલીશ હશે.

સામાન્ય રીતે જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે શેરબજારમાં વધઘટનું પ્રમાણ વધારે તીવ્ર હોય છે પરંતુ આ વખતે તોડુંક અલગ ચિત્ર છે અને સંસદમાં તે વાસ્તવમાં કોઈ કામકાજ થાય તેવી સંભાવના નથી લાગતી. વિપક્ષોની ગેરહાજરી વચ્ચે

સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે શેરબજારમાં વધઘટનું પ્રમાણ વધારે તીવ્ર હોય છે



અને કાગળ ઉપર નફો ગણ્યા કરવાને બદલે આ બધા આઈપીઓમાં પ્રોફિટ બુકિંગ કરતા રહેવું ફાયદાકારક રહેશે. કારણ કે જો બે કે ત્રણ મહિના પછી અપેક્ષિત મંદી આવવાની હોય તો આજથી બે વર્ષ પહેલાં માર્ચ, ૨૦૧૯માં જે હાલત થઈ હતી તેવી હાલત ફરી ન થાય તે પણ ધ્યાનમાં રાખવું પડે.

કંપનીઓના પરિણામો અપેક્ષા કરતા ઘણા જ સારા આવતા જાય છે અને તેમાં પણ ઈન્ફોર્મેશનનો જોરદાર માંગને કારણે સ્ટીલ અને સિમેન્ટ સેક્ટરમાં અત્યારે એક પછી એક કંપનીઓના નફા જોરદાર આવ્યા. તાતા સ્ટીલ માટે રૂ. ૧૪૦૦૦ ધસનો ભાવ દર્શાવ્યો હતો અને તેની સરખામણીમાં વધારે તીવ્રતાથી આ શેર અત્યારે જ રૂ. ૧૪૬૨ ઉપર તે આવી ગયો છે અને આ માહોલને કારણે તેમાં રૂ. ૧૫૫૦નો ભાવ જોવા મળી જાય તો નવાઈ નહિ લાગે. મેટલ સેક્ટરમાં આ જ પ્રકારનો ટ્રેન્ડ જેએસએલ્યુ સ્ટીલ, તાતા મેટાલિક્સ, હિન્ડાલ્કો, નેશનલ એલ્યુમિનિયમ વગેરે શેરોમાં શરૂ થઈ ગયો છે અને સરકાર પણ હવે આવતા ચાર-ચાર આઈપીઓ લાવી રહ્યા છે અને આવતા થોડા અઠવાડિયા પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળશે. એટલે કે સરળ ભાષામાં સમજાવીએ એ તો બે મહિના ફૂલગુલાબી તેજ અને તેમાં આ બધા આઈપીઓને તારી દેવાય અને પછી થોડા મહિનાનો નબળાઈનો તબક્કો આવે તે સંભાવના પૂરે પૂરી છે અને તેથી લાગેલા આઈપીઓમાં દેખાતા નફાથી પુશ થયા કરવાને બદલે

સરકાર વિવિધ પરિણામો પસાર કરે તે સંભાવના લાગી રહી છે. રોલઓવરને દિવસે જે રીતે ભારતીય બજારમાં ઝડપી ઉછાળો જોવાયો અને તે પછી શુક્રવારે પૂલતાની સાથે જ સેન્સેક્ષમાં એક તબક્કે ૫૨.૮૮૩૦ લેવલ પહોંચી ગયું હતું અને તે પછી ઝડપી પ્રોફિટ બુકિંગ સાથે એક તબક્કે નેગેટીવ ઝોનમાં જઈને સેન્સેક્ષ ૫૨.૭૪૦૮ના લેવલ આસપાસ આવી ગયો અને તે બતાવે છે કે બજાર હવે નવા ઘટાડાના મુડમાં નથી.

જે રીતે ટોચના ફંડ મેનેજરો એક પછી એક આઈપીઓ લાવી રહ્યા છે તે પણ સ્પષ્ટ દર્શાવે છે કે બજારનો મુડ એકંદરે પોઝિટિવ રહેશે અને તેમની આ ગણતરી પાછળ જ તેઓ આટલા કોરોડોના આઈપીઓ લાવી રહ્યા હોય, પરંતુ સાથે સાથે એ સંકેત પણ જાણવો રહ્યો છે જે ઝડપથી આ ફંડમેનેજરો

અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા સ્પષ્ટ સંકેત આપી દેવાયો કે નજીકના સમયગાળામાં તેઓ સ્ટીમ્યુલસ પેકેજ પાછું નહિ ખેંચે અને ફેડરલ રિઝર્વના આ સંકેત પછી ગયા અઠવાડિયાની વધારો દેખાય છે અને આ પાસાને કારણે હવે બેંકો માટેનો પરાબ સમય પૂરો થઈ ગયો અને હવે એકંદરે જુલાઈથી શરૂ થતા ક્વાર્ટરમાં તેમની ધિરાણ વૃદ્ધિ અને વસુલાત સુધારો તે આશાવાદ વધ્યો છે.

કે-ટ્રેડિંગમાં કેવી રીતે કમાવાય ?

ખૂબ જ ઓછા મૂકીરોકાણથી સાંકડા કમાઈ લેવા માટે શેરબજારના લગભગ ૫૦ ટકા સોદાઓ કે-ટ્રેડિંગના યાથ છે અને કે-ટ્રેડિંગમાં કેવી રીતે શેર પસંદ કરવો અને ક્યારે તેમાં એન્ટ્રી લેવી તે અંગેની વિસ્તૃત સમજ આપતું આ અંગ્રેજી પુસ્તક છે. અને અમારા ડારા રૂ. ૨૫૦ની મૂળ કિંમતનું આ પુસ્તક ખાસ ડિસ્કાઉન્ટ કિંમતમાં ઓફર થયું છે. રૂ. ૨૫૦-૨૫ = રૂ. ૨૦૦

ઓનલાઇન ખરીદો GyanPothi.com

શેરબજારનું ટેકનિકલ એનાલિસીસ સમજો

ચાલકના દર અંકમાં સાઈ એનાલિસીસ આપીને છીએ. આ એનાલિસીસ સમજવા ડો. હર્ષ કમદાર લિખિત એક ગુજરાતી પુસ્તક રચાય છે. ડો. હર્ષ કમદાર દ્વારા સરળ ભાષામાં સાઈ એનાલિસીસની સમજ આપી છે. આ પુસ્તક ખરીદવા ચાલકવ ગ્રુપ દ્વારા ખાસ રૂ. ૧૫ ડિસ્કાઉન્ટ રૂ. ૧૦૫

ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર

આ પુસ્તક અત્યારે અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે પરંતુ આ પુસ્તકને શેરબજારના બાઈબલ તરીકે વિશ્વભરમાં ઓળખવામાં આવે છે અને શેરબજાર અંગે કશું પણ શોધવા માંગતા ઇન્વેસ્ટરે આ પુસ્તક ભલે વાંચી નહિ પરંતુ દરરોજ રાત્રે માથા નીચે મૂકીને સુઈ જવા માટે વાંચી શકાય.

ઓનલાઇન ગ્રોહામ દ્વારા લખાયેલા આ પુસ્તકનો વિસ્તૃત અભ્યાસ વિશ્વાના સૌથી ઘનાટ્ય ઇન્વેસ્ટર વોરેન બફેટ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ પુસ્તકની એકેએક સલાહ વોરેન બફેટે તેમના ઇન્ટરવ્યુમાં આપવાની છે અને કદાચ તેને કારણે તેઓ જોરદાર સફળ થયા.

આ પુસ્તક ખરીદવા ચાલકવ ગ્રુપ દ્વારા ખાસ કિંમત રૂ. ૭૫૦

ઓનલાઇન ખરીદો GyanPothi.com
GooglePay ૯૮૨૪૨૩૨૪૨૪ દ્વારા પણ પેમેન્ટ કરી શકાશે
પેટીએમ ૯૮૨૪૨૩૨૪૨૪ દ્વારા પણ પેમેન્ટ કરી શકાશે

આખરમાં અમેરિકન બજારોમાં સુધારાનો ટ્રેન્ડ જોવાયો હતો. ગયા અઠવાડિયા દરમ્યાન ફેડરલ રિઝર્વની મીટીંગ પછી તેના પ્રમુખે આ સંકેત આપ્યો છે તે જ પ્રકારે ગયા અઠવાડિયા દરમ્યાન અમેરિકાની ટોચની ટેકનોલોજી કંપનીઓના પરિણામો પણ આવ્યા અને આ પરિણામો પણ અપેક્ષા કરતા ખૂબ જ સારા આવ્યા છે તેમ છતાં પણ એમેઝોન, પ્રિન્ટરેસ્ટ વગેરે ન્યુએજ કંપનીઓના શેરોમાં ઘટાડો જોવાયો હતો. એમેઝોનનો શેર સારા પરિણામ છતાં પણ ૭.૪૮ ટકા ટૂટ્યો હતો. જ્યારે પ્રિન્ટરેસ્ટના શેરોમાં પણ ૧૯ ટકાનો તોર્તાંગ ઘટાડો જોવાયો હતો. અને તેનું મુખ્ય કારણ આ શેરો અતિશય વધી ગયા હોવાનું છે. અને એમેઝોન અને અન્ય શેરો ટૂટવાને કારણે ટેકનોલોજી ઈન્ડેક્સના ટોચના શેરોમાં ઘટાડો થયો હતો. સામે પક્ષે અમેરિકાના રોજગારીના આંકડા ઘણા જ પ્રોત્સાહક છે. અને તેને કારણે પણ સેન્ટીમેન્ટ એકંદરે મજબૂત છે. જ્યારે એશિયાઈ બજારોમાં અત્યારે કોન્સોલિડેશન અને ટૂંકી વધઘટનો તબક્કો ચાલી રહ્યો છે. અને તેમાં મોટા ગણનાની સંભાવના હાલના તબક્કે નથી દેખાતી.

બેંક શેરોમાં આ તબક્કે ખેલાડીઓનું મુખ્ય ફોકસ આઈસીઆઈસીઆઈ બેંકના શેર ઉપર છે. અત્યારે રૂ. ૬૮ ઉપર આવેલા આ શેરમાં પરિણામનો સુંદર સપોર્ટ છે અને તે સપોર્ટને કારણે આ શેર આવતા થોડા અઠવાડિયામાં મજબૂત રીતે રૂ. ૭૦૭ અને તે પછી રૂ. ૭૨૭નો ભાવ હાંસલ કરી લે તે સંભાવના મજબૂત છે. થોડા મહિના પહેલા સ્પષ્ટ રીતે લખેલું તેમ આઈસીઆઈસીઆઈ બેંક રૂ. ૮૦૦ તરફ આગળ વધી રહ્યો છે અને તેથી લોંગટર્મ ઈન્વેસ્ટમેન્ટની રીતે પણ તેમાં થોડુંક રોકાણ કરી દેવાય.

સામે પક્ષે એક્સિસ બેંકનો શેર છેલ્લા થોડા સમયથી ઘટાડાના તબક્કામાં છે. એક્સિસ બેંકના પ્રથમ ક્વાર્ટરના પરિણામ જોરદાર આવ્યા અને તેમ છતાં આ શેર ઘટાડાના તબક્કામાં ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં એક્સિસ બેંકનો રૂ. ૭૧૭ વાળો શેર એક વખત ડેટો નવાઈ નહિ લાગે, પરંતુ આ કારણના તબક્કામાં થોડા થોડા શેરો એસઆઈપીની રીતે ભેગા કરતા જશે અને એક વખત ક્રેકેશન પતે તે પછી તેમાં ઝડપી ઉછાળા સાથે રૂ. ૭૩૦નો ભાવ આવી જતા વાર નહિ લાગે.

સામે પક્ષે એચડીએફસી બેંકનો શેર પણ છેલ્લા ઘણા સમયથી ઘટાડાના તબક્કામાં છે. એચડીએફસી બેંક અત્યારે રૂ. ૧૪૨૨ ઉપર આવ્યો છે. પરંતુ આ બેંકની એક ખાસિયત છે કે ફંડ મેનેજરોની આ શેર તરફ જોરદાર આકર્ષણ રહ્યું છે અને દેશના તમામ ટોચના ફંડ મેનેજરોએ આ શેર માટે એન્ટ્રીઓ આપી છે. ૧૮૦૦ ધસના ભાવનું લક્ષ્યાંક આપ્યું છે એટલે કે અત્યારના ભાવે મજબૂત કહેવી અતિશયોક્તિ નથી અને તેથી આ શેરમાં એક્સપોઝર વધારતા જવું.

ફેડરલ રિઝર્વના ૧૯૧ ઉપર આવી ફંડ મેનેજર ખૂબ જ ભુલીશ છે. શેર અત્યારે રૂ. ૮૫-૮૬ ઉપર ચાલે છે અને તેમાં ટોચના ફંડ મેનેજરોએ રૂ. ૧૦૩થી રૂ. ૧૧૦૦ લક્ષ્યાંક આપ્યું છે. એટલે કે લગભગ ૨૦ ટકા કરતા વધારે રિટર્ન થયું. તેમાં નાનું રોકાણ કરી શકાય.

ઈન્ડોસ્ટ્રીયલ બેંક દ્વારા સુંદર પરિણામો રજૂ થયા. તેના આંકડાઓ ધ્યાનમાં રાખીએ અને સામે પક્ષે કોમર્શિયલ વાહનોના વેચાણો હવે સુધરી રહ્યા છે તે પાસું જોઈએ તો આ શેરમાં આકર્ષણ છે પરંતુ આ શેરમાં વેલ્યુએશન અંગે ફંડ મેનેજરોમાં ભારે વિરોધાભાસ છે. કેટલાક ફંડમેનેજરો

ડ્રાઈવર ?

staffavailable.com

ડ્રાઈવર, રસોયા, નોકર શોધવા હવે ખૂબ જ સરળ staffavailable.com ના એકદમ અલગ પ્રકારના અને દેશમાં એકમાત્ર આવી સવાલ ઓફર કરતાં પ્લેટફોર્મ ઉપર તમારી જરૂરિયાત મૂકી દો તદ્દન ફ્રી

આકર્ષણ રહ્યું છે અને દેશના તમામ ટોચના ફંડ મેનેજરોએ આ શેર માટે એન્ટ્રીઓ આપી છે. ૧૮૦૦ ધસના ભાવનું લક્ષ્યાંક આપ્યું છે એટલે કે અત્યારના ભાવે પણ તેમને શેર ભેગા કરી તો ૧૨ મહિને તેમાં ૩૦ ટકા કરતા વધારે રિટર્ન છૂટી શકે અને આ રિટર્ન એકદમ સલામત હોય તે સ્વાભાવિક છે કારણ કે એચડીએફસી બેંક ભારતની સૌથી મજબૂત કંપની કહી શકાય અને તેને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કરતા વધારે મજબૂત કહેવી અતિશયોક્તિ નથી અને તેથી આ શેરમાં એક્સપોઝર વધારતા જવું.

ફેડરલ રિઝર્વના ૧૯૧ ઉપર આવી ગયેલો આઈસીઆઈસીઆઈ બેંકનો શેર હવે કારેકશનના છેલ્લા અઠવાડિયામાં છે. કદાચ નવા અઠવાડિયા અથવા તો દસેક દિવસમાં કારેકશન પૂર્ણ થાય અને આ શેર ઝડપથી મજબૂત થઈ શકાય. ૨૩૮૦ સુધી સંભાવના મજબૂત છે અને તેથી આ શેર ઉપર ખાસ ધ્યાન રાખવું અને આ શેર પણ તમને કમાઈ આપશે.

સામે પક્ષે રૂ. ૧૮૧ ઉપર આવી ગયેલો આઈસીઆઈસીઆઈ બેંકનો શેર હવે કારેકશનના છેલ્લા અઠવાડિયામાં છે. કદાચ નવા અઠવાડિયા અથવા તો દસેક દિવસમાં કારેકશન પૂર્ણ થાય અને આ શેર ઝડપથી મજબૂત થઈ શકાય. ૨૩૮૦ સુધી સંભાવના મજબૂત છે અને તેથી આ શેર ઉપર ખાસ ધ્યાન રાખવું અને આ શેર પણ તમને કમાઈ આપશે.

સામે પક્ષે રૂ. ૧૮૧ ઉપર આવી ગયેલો આઈસીઆઈસીઆઈ બેંકનો શેર હવે કારેકશનના છેલ્લા અઠવાડિયામાં છે. કદાચ નવા અઠવાડિયા અથવા તો દસેક દિવસમાં કારેકશન પૂર્ણ થાય અને આ શેર ઝડપથી મજબૂત થઈ શકાય. ૨૩૮૦ સુધી સંભાવના મજબૂત છે અને તેથી આ શેર ઉપર ખાસ ધ્યાન રાખવું અને આ શેર પણ તમને કમાઈ આપશે.

ગામની ગપસપ

- **ઈન્ડોસ્ટ્રી**, થોડા અઠવાડિયા આરામ કર્યા પછી સેન્સેક્ષ અને નિફ્ટી હવે ફરી વખત ઢોડવા માટે સજાજ. ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવશે કે કેમ તે ખબર નથી પરંતુ તમને સાંકડું રિટર્ન આપી શકશે.
- **તાતા સ્ટીલ**, રૂ. ૧૪૦૦નો ભાવ કહ્યો હતો. અને તે લેવલ કૂદાવી દીધું. આગામી દિવસોમાં રૂ. ૧૫૫૦ના લેવલની સંભાવના મજબૂત.
- **જેએસએલ્યુ સ્ટીલ**, તાતા સ્ટીલની પાછળ પાછળ ઢોડી રહ્યો છે. અત્યારના રૂ. ૭૩૮ના ભાવે આકર્ષક, આવતા થોડા દિવસોમાં રૂ. ૮૪૮ના ભાવની સંભાવના મજબૂત.
- **તાતા સ્ટીલ ઓલચેલપી**, એલચેલપી એટલે લાંબુ લયક પ્રોફિટ. અત્યારે રૂ. ૧૧૬૧ ઉપર છે અને આવતા થોડા દિવસોમાં રૂ. ૧૨૬૧ ઉપર આવવાનો, થોડા શેરો લઈને મૂકી દેશે.
- **જિંદા સ્ટેલોસ સ્ટીલ**, અગાઉ પણ ભેગા કરવાનું કહ્યું હતું, અત્યારે રૂ. ૧૫૮ ઉપર આવ્યો છે. થોડા દિવસોમાં રૂ. ૧૭૮ના ભાવની ગણતરી.
- **માઈલ્સ-ટ્રી**, લાર્સન એન્ડ ટુબોવાળાની કંપની, અત્યારે રૂ. ૨૭૮૬ ઉપર ચાલે છે અને આવતા થોડા દિવસોમાં રૂ. ૨૯૮૬ના ભાવની સંભાવના મજબૂત.
- **મેટ્રીમની.કોમ**, ન્યુએજ શેરોમાં આકર્ષક અને તેમાં મેટ્રીમનીની લગભગ મોનોપોલી જેવી પોઝિશન. શાદી.કોમ છે. પરંતુ મેટ્રીમની અગ્રેસર, રૂ. ૧૧૮૩માં પોટો નથી. અને આવતા થોડા દિવસોમાં રૂ. ૧૩૪૩ના ભાવની ગણતરી.
- **તાતા મેટાલિક્સ**, રૂ. ૧૩૩૪વાળા આ શેરમાં સુંદર ઉછાળાની ગણતરી, થોડા દિવસોમાં રૂ. ૧૪૪૪ના ભાવની સંભાવના મજબૂત.
- **એલવુ ડાલકિયાન**, રોટરસાઈકલ અને ઇલેક્ટ્રો માટેની ચેઈન બનાવે છે. રૂ. ૫૩૪ના ભાવે આકર્ષક, ઝડપથી રૂ. ૫૦ની નોટ આપી જાય.
- **ઈન્ડોનિપોન ઇલેક્ટ્રિકલ**, ઓટોમોબાઈલમાં આ કંપનીના
- **ઈન્ડોસ્ટ્રી**, પ્રથમ ક્વાર્ટરના વોલ્યુમમાં સુંદર વૃદ્ધિ, નફો પણ સારો આપશે, મજબૂત સુધારા સાથે રૂ. ૭૭૭થી વધીને રૂ. ૮૨૦ના ભાવની ગણતરી.
- **લાલા કમ્પ્યુટર**, પ્રથમ ક્વાર્ટરના વોલ્યુમમાં સુંદર વૃદ્ધિ, નફો પણ સારો આપશે, મજબૂત સુધારા સાથે રૂ. ૭૭૭થી વધીને રૂ. ૮૨૦ના ભાવની ગણતરી.
- **સ્ટેલોસ સિમેન્ટ**, પ્રથમ ક્વાર્ટર દરમ્યાન સિમેન્ટ વોલ્યુમમાં સુંદર વૃદ્ધિ, કદાચ નફો એટલો વધીને ન આવે તેમ છતાં શેરમાં જોરદાર આકર્ષક, રૂ. ૭૧૮ના ભાવે થોડાક શેરો લઈને મૂકી દેવાય. શેન્ટર્ટર્મમાં જ રૂ. ૭૩૦ના ભાવની ગણતરી.
- **સેલોડીઆઈ લાઈફ**, કોરોના મહામારી પછી લોકોની ફાટી ગઈ છે અને ખર્ચા ઘટાડીને વીમાની પોલીસી લેવાની તત્પરતા. એસબીઆઈ લાઈફને ફાયદો, રૂ. ૧૦૫૨ના ભાવે આકર્ષક, આંકડાની અદલાબદલી થવાની, રૂ. ૧૨૦૫ બતાવે.
- **ઈન્ડોસ્ટ્રી**, નફો સુંદર આવ્યો અને ફંડ મેનેજરોએ દિલથી શેરો ભેગા કર્યા છે. રૂ. ૧૫૮૦ના ભાવે મફત છે. સુંદર ઉછાળા સાથે રૂ. ૧૬૮૦ થઈ જવાની ગણતરી.
- **લાર્સન એન્ડ ટુબો**, સરકાર અત્યારે રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઉપર જોરદાર ફોકસ કરાવે છે. લાર્સનને મોટો ફાયદો, રૂ. ૧૬૦૮માં ધ્યાનમાં રાખજો, આંકડાની અદલાબદલી નજીક છે. રૂ. ૧૮૦૬ નજીકના સમયગાળામાં જ જોવાય.
- **સાઈસીઆઈસીઆઈ બેંક**, સેન્ટીમેન્ટમાં સુંદર ઉછાળો, નફો સુંદર આવ્યો, રૂ. ૬૬૭માં થોડાક શેરો લઈને મૂકી દો, નજીકના દિવસોમાં જ રૂ. ૭૬૬નો ભાવ જોવા મળવાની આશરસની વાત.
- **ઓપોલો લોસ્ટિવલ**, કામગીરીમાં નોંધપાત્ર સુધારો, વધીને રૂ. ૭૭૬૨ ઉપર આવ્યો છે. નજીકના દિવસોમાં જ રૂ. ૪૦૦૦ના ભાવની ગણતરી.
- **માઈલ્સ-ટ્રી**, લાર્સનવાળાની કંપની, રૂ. ૨૭૩૨ના ભાવે પણ આકર્ષક, ઝડપથી રૂ. ૩૦૦૦નો ભાવ થોડા અઠવાડિયામાં જોવા મળવાની ગણતરી.

PRATIKSHA CHEMICALS LIMITED				
REGD. OFFICE: 3RD FLOOR, H K COMPLEX, OPP. DHARNIDHAR DERASAR, VASNA, AHMEDABAD - 380007				
CIN : L24110GJ1991PLC015507 www.pratikshachemicals.in				
PH : 079-26632390 E-MAIL: exports@dharaipraticksha.com				
EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.06.2021 (Rs. In Lacs)				
Sr. No	PARTICULARS	Quarter ended on 30th June, 2021	For the year ended on 31st March, 2021	Corresponding 3 Months Ended on 30th June 2020
1	Total income from operations	345.49	1136.12	140.94
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	13.16	42.64	1.49
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	13.16	42.64	1.49
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	10.81	46.64	1.11
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	10.81	46.64	1.11
6	Equity Share Capital	557.03	557.03	557.03
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	(221.64)	(232.46)	(277.98)
8	Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations)	0.19	0.84	0.02
	Basic :	0.19	0.84	0.02
	Diluted :	0.19	0.84	0.02

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.pratikshachemicals.com)
2. The result of the Quarter ended on 30th June, 2021 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 2nd August, 2021

BY ORDER OF THE BOARD OF DIRECTORS,
FOR, PRATIKSHA CHEMICALS LIMITED
SD/-
JAYESH PATEL
DIRECTOR
(DIN: 00401109)

Place : Ahmedabad
Date : 2nd August, 2021